

13 જૂન 2018

બ્રેમ્પટનના આર્થિક ભવિષ્ય માટેનો નવું સૂચિત વિગતવાર સમયપત્રક (roadmap)

બ્રેમ્પટન, ઓન્ટારિયો – બ્રેમ્પટન સીટી કાઉન્સિલે [નવો આર્થિકવિકાસ માર્સ્ટર પ્લાન](#)ને મંજૂર કર્યો છે, જેમાં બ્રેમ્પટનમાં રોજગાર અને રોકાણ આકર્ષવા માટેના લક્ષ્યો અને યુક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

સીટીનું ધ્યેય તે છે કે બ્રેમ્પટનને ઈનોવેશન, પ્રતિભા, રોજગાર અને રોકાણના ક્ષેત્રે નિશ્ચિત લક્ષ્યાંકો સાથે વૈશ્વિક આગેવાન તરીકે સ્થાપવાનું છે – જેમાં સમાવેશ થાય છે આગામી 20 વર્ષમાં બ્રેમ્પટનમાં 140,000 નવી નોકરીઓ ઊભી કરવી. તેમાં ઈનોવેશન, પ્રતિભા, સ્પર્ધાત્મકતા અને રોકાણના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં શું પગલાં લેવામાં આવશે તેનું વિવરણ છે. સૂચવવામાં આવેલા કેટલાક પગલાં તો લેવામાં આવી પણ ચુક્યા છે અને બાકીના પગલાં વિશે અંદાજપત્રની ચર્ચામાં સંસાધનો અથવા રોકાણના પુનઃવિતરણ અંગેના નિર્ણયો લેવાશે. આ પ્લાન રાયેરસન યુનિવર્સિટી અને શેરિડાન કોલેજ સાથેની ભાગીદારીમાંથી [નવું ડાઉનટાઉન કમ્પસ અને સેંટર ફોર ઈનોવેશન](#) માંથી ઉદ્ભવતી તકોનો પણ ઉપયોગ કરશે.

ઈકોનોમિક ડેવેલપમેન્ટ માર્સ્ટર પ્લાન રોજગાર અને રોકાણના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગ્રેટર ટોરોન્ટો એરપોર્ટ ઓથોરિટી સાથે આર્થિક કડીઓ બનાવવા સહિત ખાનગી અને જાહેર ક્ષેત્રો સાથેની ભાગીદારી અને સહયોગની જરૂરિયાત અંગેનું વિવરણ કરે છે.

પ્લાનની મંજૂરીની સાથોસાથ, સીટી કાઉન્સિલે તેમના કર્મચારીગણને ડાઉનટાઉનની ઉપલબ્ધ હોય તેવી ખાલી જગ્યાઓને બિઝનેસ ઈન્ક્યુબેટર અને સહકારથી કાર્ય કરવાની જગ્યામાં રૂપાંતરિત કરવા અધિકૃત કર્યા છે જેમાં રાયેરસન યુનિવર્સિટી પોતાના ઈનોવેશન અને ઈન્ક્યુબેશન એટલે કે વ્યાપારિક ઉષ્માયન અંગેના વિસ્તૃત અનુભવમાંથી શીખેલી હકીકતો અને શ્રેષ્ઠ પ્રણાલિઓ શીખવશે.

બ્રેમ્પટનની ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર ઓફિસે આ પ્લાનના વિકાસાર્થે 2017માં પ્રક્રિયા શરૂ કરી જેમાં ઐતિહાસિક આર્થિક સૂચકો અને બ્રેમ્પટનની પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિનું વિશ્લેષણ સામેલ છે. કન્સલટન્ટ E&Y ની મદદથી સીટીએ શીખેલી હકીકતો અને શ્રેષ્ઠ પ્રણાલિઓ સમજવા માટે છ સરખામણીકારક શહેરો પર નજર કરી જે બ્રેમ્પટન સમાન અનુભવોમાંથી પસાર થયેલ શહેરો હતાં. બ્રેમ્પટન વ્યાપારના પ્રતિનિધિઓ, એનજીઓ, સીટીના કાઉન્સિલરોની બનેલ સ્ટ્રાટિજી સમિતિ અને કર્મચારીગણે કાર્યને માર્ગદર્શન પૂરું પાડ્યું અને અંતિમ પ્લાન અને ભલામણોને ટેકો આપ્યો.

આગામી પગલા તરીકે, ઈકોનોમિક ડેવેલપમેન્ટ કર્મચારીગણ રોજગાર નિર્માણ, રોકાણ, ઈનોવેશન અને સાહસિકતા માટેના કામગીરીના મેટ્રિક્સનો વિકાસ કરશે. મહત્વના ભાગીદારો અને જૂથો માટેની ભૂમિકાઓ સૂચિત કરવા કાર્ય કરાશે અને જેમ જેમ એકશન પ્લાનનો અમલ થશે અને પરિણામો મપાશે એટલે કર્મચારીગણ સુનિશ્ચિત કરશે કે મહત્વના પ્રેક્ષકો સાથે યોગ્ય સંવાદ સ્થાપવામાં આવે.

ક્વોટ:

"બ્રેમ્પટનનું ધ્યેય અન્ય કેનેડિયન અને વૈશ્વિક શહેરોના નોંધપાત્ર સ્પર્ધક બનવાનો છે. આ અહેવાલ ક્ષિતિજ પર જણાઈ આવતા મહત્વપૂર્ણ આર્થિક તોફાનો વિશે વાત કરે છે - પરંતુ સારા સમાચાર એ છે કે આપણી સ્પર્ધાત્મકતા અને ભવિષ્યના આયોજન વધારવા માટે આપણે અગાઉથી જ કેટલાક હિમ્મતભર્યા પગલાં લઈ ચુક્યા છીએ. છેવટે, આ અહેવાલ આપણને સૂઝથી જોખમો લેવા, રોકાણની પ્રવૃત્તિઓ વધારવા અને સીટી ઓફ બ્રેમ્પટનમાં વર્ધિત ઈનોવેશન અને સ્પર્ધાત્મકતા હાંસલ કરવા માટે વ્યાપારિક સમુદાયો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેની ભાગીદારીઓ સ્વીકારવા પ્રોત્સાહિત કરે છે."

- *બ્રેમ્પટન મેયર લિન્ડા જેકી*

"જેમ જેમ ઈકોનોમિક ડેવેલપમેન્ટ માસ્ટર પ્લાન પ્રક્રિયા પ્રકટ થઈ, અમે બ્રેમ્પટનનાં તેમજ બહારના ઘણાં હિસ્સાધારકો પાસેથી અગ્રિમતાઓ અને કલ્પનાઓ વિશે અમે સાંભળ્યા છે. પ્લાન હિમ્મતભર્યો છે અને સફળતા માટે ચાલુ રહેતા નિવેશ અને ભાગીદારીઓની આવશ્યકતા છે જેમાં સીટીના ધ્યેયો સાથે સ્પષ્ટ અને વારંવાર માપનો થતા રહેશે."

- *કાઉન્સિલર જેક બોમૅન, ઈકોનોમિક ડેવેલપમેન્ટ ચેર*

"અમારા લક્ષ્યો હાંસલ કરવા માટે ભાગીદારી અને સહયોગ હવે ક્યારેય ન હતાં એટલા વધુ મહત્વપૂર્ણ છે. આ પ્લાન આપણા વ્યાપારિક સમુદાય સાથે, ટોરોન્ટો ગ્લોબલ જેવા સંગઠનો સાથે, રાયરસન અને શેરિડન જેવા શૈક્ષણિક ભાગીદારો સાથેના મજબૂત કામકાજના સંબંધો વિકસાવવાની અને GTAA સાથે આર્થિક જોડાણો ઊભા કરવાની જરૂરિયાતને પિછાણે છે."

- *બૉબ ડાર્લિંગ, ડાયરેક્ટર, બ્રેમ્પટન ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર*

ઈકોનોમિક ડેવેલપમેન્ટ માસ્ટર પ્લાનની હકીકતો:

- **છ સરખામણીકારક શહેરો:** સરે, બીસી, ઓસ્ટિન, ટેક્સાસ, સેન હોસે, કેલિફોર્નિયા, શાર્લટ, નોર્થ કેરોલિના, કોલમ્બસ, ઓહાયો અને ઓસ્લો, નોર્વે
- **સ્ટિઅરિંગ સમિતિના સદસ્યો:** કિલ્ક બેન્સન, VSETA એન્જિનિયરિંગ અને બ્રેમ્પટન માસ્ટરમાઈન્ડ; જો ક્રમ્પ, દ ક્રમ્પ ગ્રૂપ, ઈન્ક (The Crump Group, Inc.); નેટલી ફાન્સિસ, માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ; કંવર ધંજલ, જસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ઈન્ક (Just Instruments Inc.); ઈવાન મૂર, પ્રુસ, ડેશ એન્ડ ક્રાઉચ, એલએલપી (Prouse, Dash & Crouch, LLP); રોડ રાઈસ, રાઈસ ડેવેલપમેન્ટ કોર્પ (Rice Development Corp.); હિથર સ્ટ્રાટી, ડેલોઈટ પ્રાઈવેટ, અને પ્રમુખ, બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ (Brampton Board of Trade); શાલિની દા કુન્ડા, એગ્રિફ્યુટિવ ડાયરેક્ટર, પીલ હાલ્ટન વર્કફોર્સ ડેવેલપમેન્ટ ગ્રૂપ (Peel Halton Workforce Development Group); કાઉન્સિલર જેક બોમૅન; કાઉન્સિલર ડુગ વિલવાન્સ
- **ધ્યાન કેન્દ્રિત કરવાના મહત્વના ક્ષેત્રો :** પ્રતિભા અને કર્મચારીગણ; રોકાણ; ઈનોવેશન અને ટેકનોલોજી; રોજગારની જગ્યાઓ; અને સ્પર્ધાત્મકતા



- માસ્ટર પ્લાનનો [બ્રેમ્પ્ટનનું 2040 વિઝન](#) સાથે મજબૂત જોડાણ છે, અને તે એવી પ્રવૃત્તિનો અમલ કરે છે જે વિઝનને બનાવે છે અને એને કારણે બ્રેમ્પ્ટન અલગ તરી આવે છે જ્યાં ઈનોવેશન, ડાઉનટાઉન વિકાસ, બ્રેમુલી અને નવા "અપટાઉન" આસપાસની કલ્પનાઓ પર ભાર મુકવામાં આવે છે.
- પહેલેથી ચાલી રહેલી કામગીરીઓમાં રાયરસન સાથેની ભાગીદારીમાં ઈનક્યુબેટર / કો-વર્કિંગ સ્પેસ, એક રોકાણ આકર્ષણ વ્યૂહરચનાના વિકાસ, અદ્યતન ઉત્પાદન સુપરક્લસ્ટરથી સંબંધિત પ્રતિભા અને ક્ષમતા વિકાસ, બ્રેમ્પ્ટન વ્યાપારિક લોકો અને સાહસિકો માટેના ઓનલાઇન નેટવર્કિંગ પ્લેટફોર્મના પ્રારંભ અને આર્થિક જોડાણો ઊભા કરવા, અને GTAA ને નિવેદન કરવાનો સમાવેશ થાય છે.

-30-

બ્રેમ્પ્ટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પ્ટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.